

RAN-1905000103040001
S. Y. LL. B. (Sem.-III) Examination March - 2026
Principles of Taxation
[Total Marks: 100

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book. (2) પ્રશ્નક્રમાંક બદલશો નહીં. Do not change question numbers. (3) જમણી તરફના અંક ગુણ દર્શાવે છે. Figures to the right indicate marks. (4) ઉત્તરોના સમર્થનમાં મહત્વના કેસ-લો ચર્ચો. Discuss important case-law in support of given answers.	Seat No.: Student's Signature
---	--

- પ્ર-1.** આવકવેરા અધિનિયમ, 1961 અન્વયે રહીશ, રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં અને બિનરહીશ વ્યક્તિનો હોદ્દો નક્કી કરવાની જોગવાઈઓ સમજાવો. **14**
- અથવા**
- પ્ર-1.** આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ સર્વે, સર્ચ અને સીઝરની જોગવાઈઓ સમજાવો. **14**
- પ્ર-2.** આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ ધંધો વ્યવસાયની આવકની ગણતરી કરતી વખતે બાદ ન મળતા ખર્ચાઓ સમજાવો. **14**
- અથવા**
- પ્ર-2.** આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ પેનલ્ટીની જોગવાઈઓ સમજાવો. **14**
- પ્ર-3.** આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ સમજાવો. (કોઈપણ બે) **16**
- 1) કલમ 80 યુ ની કપાત.
 - 2) કલમ 80 ડી ની કપાત.
 - 3) કલમ 80 ડીડીબી ની કપાત.
 - 4) કલમ 80 સી ની કપાત.
- પ્ર-4.** ગુડ્સ અને સર્વિસીઝ ટેક્સ એક્ટ, 2017 હેઠળ આકારણીના પ્રબંધોની વિગતવાર ચર્ચા કરો. **14**
- અથવા**
- પ્ર-4.** ગુડ્સ અને સર્વિસીઝ ટેક્સ એક્ટ, 2017 હેઠળ નોંધણી અંગેની જોગવાઈઓ સમજાવો. **14**
- પ્ર-5.** ગુડ્સ અને સર્વિસીઝ ટેક્સ એક્ટ, 2017 હેઠળ સમજાવો (કોઈપણ બે) **12**
- 1) અધિકારીઓની સત્તા.
 - 2) રીફંડ.
 - 3) માલ પૂરો પાડવાનું સ્થળ.
 - 4) જીએસટીના ફાયદાઓ અને ગેરફાયદાઓ.

પ્ર-6. ગુડ્સ અને સર્વિસીઝ ટેક્સ એક્ટ, 2017 હેઠળ વેરો લેવા અને વસૂલ કરવા બાબત વિગતવાર નોંધ લખો. 14

અથવા

પ્ર-6. સમજાવો ગુડ્સ અને સર્વિસીઝ ટેક્સ એક્ટ, 2017 હેઠળ હિસાબી ચોપડા રાખવા અને ઓડિટ. 14

પ્ર-7. આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ સમજાવો (કોઈપણ બે) 16

- 1) ખેતીની આવક.
- 2) કર્મચારીની કરપાત્ર સવલતો.
- 3) પરમેનન્ટ એકાઉન્ટ નંબર મેળવવાની જોગવાઈઓ.
- 4) પગારની આવકમાંથી મળતી કપાતો.

ENGLISH VERSION

Q-1. Explain the provisions of deciding the status of the assessee into Resident, Resident but not ordinary Resident and non-resident under the Income Tax Act, 1961. 14

OR

Q-1. Discuss in detail survey, search and seizure under the Income Tax Act, 1961. 14

Q-2. Explain the expenses not deductible while computing Income from business or profession under the Income Tax Act, 1961. 14

OR

Q-2. Explain penalty provisions under the Income Tax Act, 1961. 14

Q-3. Explain under the Income Tax Act, 1961 (Any 2) 16

- 1) Deduction U/S 80U.
- 2) Deduction U/S 80D.
- 3) Deduction U/S 80DDB.
- 4) Deduction U/S 80C.

Q-4. Discuss in detail the provisions of assessment under the Goods and Services Tax Act, 2017. 14

OR

Q-4. Explain the provisions of registration under the Goods and Services Tax Act, 2017. 14

Q-5. Explain under the Goods and Services Tax Act, 2017 (Any 2) 12

- 1) Powers of officers.
- 2) Refunds.
- 3) Place of Supply of Goods.
- 4) Merits and Demerits of GST.

Q-6. Write an explanatory note on levy and collection of tax under the Goods and Services Tax Act, 2017. **14**

OR

Q-6. Explain: Maintenance of books and audit under the Goods and Services Tax Act, 2017. **14**

Q-7. **Explain under the Income Tax Act, 1961 (Any 2)** **16**

- 1) Agriculture Income.
 - 2) Taxable perquisites in the hands of employees.
 - 3) Provisions for obtaining PAN (Permanent Account Number).
 - 4) Deduction from the income of salary.
-